

શુલ્કનું સમયપત્રક - નમા સેવિંગ્સ એકાઉન્ટ (૦૧ જૂન, ૨૦૨૫ થી અમલમાં)

(ઉત્પાદ બંધ કરી દેવામાં આવ્યું છે)

સરેરાશ માસિક બેલેન્સની આવશ્યકતા	RD + SIP ચાલુ રાખવા સાથે શૂન્ય (નીચે મુજબ)
કરજિયાત: AMB ના બદલે રિઝર્વિંગ ડિપોઝિટ / સિસ્ત્રોનિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન	
RD / SIP નો કાર્યકાળ RD / SIP ના ઉત્પાદન ધોરણો મુજબ હોવો જોઈએ (RD / SIP માટે ડેબિટ એકાઉન્ટ નમ્બર સેવિંગ્સ એકાઉન્ટ સમાન હોવું જોઈએ) EDGE SIP ફક્ત ૧૮ - ૫૧ વર્ષની વય જૂથના નિવાસી વ્યક્તિઓ માટે લાગુ પડે છે	દર હપ્તે રૂ. ૩૦૦૦ - મેટ્રે, શહેરી શાખાઓ દર હપ્તે રૂ. ૨૦૦૦ - અર્ધ શહેરી શાખાઓ દર હપ્તે રૂ. ૧૦૦૦ - ગ્રામીણ શાખાઓ
મહત્વપૂર્ણ:	જ્યાં સુધી ખાતું ચાલુ ન થાય ત્યાં સુધી RD / SIP માસિક ધોરણે નિયમિત રીતે લિંક / સર્વિસ (હમાની ચુકવણી) કરવી આવશ્યક છે. RD / SIP ની ચોક્કસ મુદત પૂર્ણ થયા પછી અથવા સમય પહેલા બંધ થઈ જવાના કિસ્સામાં, ગ્રાહકે ઉત્પાદન પ્રકારમાં ફેરફારનો વિકલ્પ પસંદ કરી શકે છે.
RD / SIP નો હમો ન ભરવાના કિસ્સામાં શુલ્ક (માસિક ધોરણે વસૂલવામાં આવશે)	ફેમિલી એકાઉન્ટ્સ અથવા બિઝનેસ એકાઉન્ટ્સ સાથે ચુપિંગ
ફેમિલી એકાઉન્ટ અથવા બિઝનેસ સાથે ચુપિંગ	
કન્ટ એકાઉન્ટ ચુપિંગ	લાગુ પડતું નથી
સેવિંગ્સ એકાઉન્ટ ચુપિંગ	લાગુ પડતું નથી
ચેક બુક (૨૫ લીફ્ટની PAP ચેક બુક) મર્યાદા	દર ત્રણ મહિને ૧ ચેક બુક મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ લીફ્ટ રૂ. ૩૫૫
ઉધરાણી	
સ્થાનિક ચેક ક્રેડિટિંગ	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	રૂ. ૫૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૨૫, રૂ. ૫૦૦૦ થી વધુ અને રૂ. ૧૦,૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૫૦/-, રૂ. ૧૦,૦૦૦ થી વધુ અને રૂ. ૧૦૦૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૧૦૦/-, રૂ. ૧૦૦૦૦૦ થી વધુનું શુલ્ક રૂ. ૧૫૦/-
બેંક સિવાયના સ્થળોએ અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	
RTGS ઇનવર્ડ/NEFT ઇનવર્ડ/IMPS ઇનવર્ડ	મફત
ફોરેન ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુકવણી	
શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	દર મહિને ૩ લીફ્ટ સુધી મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ લીફ્ટ રૂ. ૫૦
શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ	પ્રતિ લીફ્ટ રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખામાં RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઈન)	NEFT: રૂ. ૧૦૦૦૦/- સુધી રૂ. ૨.૨૫, રૂ. ૧૦૦૦૧ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫. RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (રિવસ દીઠ મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦/-)	૫૦૦૦૦૦ રૂપિયા સુધી: રૂ. ૨.૫/-, રૂ. ૫૦૦૦૦૦- રૂ. ૧ લાખ: રૂ. ૫/-, રૂ. ૧ લાખથી વધુ: રૂ. ૭.૫/-
રોકડ ઉધરાણી	
રહેણાંક સ્થાને રોકડ જમા (એટીએમ અને શાખા સહિત)	દર મહિને રૂ. ૧,૦૦,૦૦૦ સુધી મફત
બિન-રહેણાંક સ્થાને રોકડ જમા (એટીએમ અને શાખા સહિત)	શૂન્ય
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	રૂ. ૫/૧૦૦૦
રહેણાંક સ્થાને રોકડ ઉપાડ	મફત
બિન-રહેણાંક સ્થાને રોકડ ઉપાડ	રૂ. ૪/૧૦૦૦
મેટ્રો સ્થાનો પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહાર (અન્ય એટીએમ)	૩ વ્યવહાર
નોન-મેટ્રો સ્થાન પર ડેબિટ કાર્ડ વડે રોકડ ઉપાડના વ્યવહાર (અન્ય એટીએમ)	૫ વ્યવહાર
એટીએમ ઉપાડની મફત મર્યાદાથી વધુ શુલ્ક	પ્રતિ નાણાકીય વ્યવહાર રૂ. ૨૩, બિન-નાણાકીય વ્યવહાર રૂ. ૧૨
નોન-ઇન્ડિયન એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોકડ ઉપાડ નક્કરું	રૂ. ૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોકડ ઉપાડ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૧૧૦/- પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૨૫/- પ્રતિ વ્યવહાર
અન્ય શુલ્ક	
રૂપે / વિદેશી કલાસિક ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૧૮૮
વિદેશી / રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૧૮૮
વિદેશી ગોલ્ડ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૨૫૦
ELITE / વિદેશી સિગ્નેચર ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકરણ માટેના શુલ્ક)	રૂ. ૬૦૦
કાર્ડ વડે વ્યવહારની સ્લિપની પુનઃપ્રાપ્તિના શુલ્ક (ખોટા દવાઓ માટે)	રૂ. ૨૫૦/- પ્રતિ સ્લિપ

રોપ પેમેન્ટ સિંગલ ચેક (ઓનલાઇન મફત)	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
રોપ પેમેન્ટ સિરીઝ (ઓનલાઇન મફત)	રપ ચેક્કી સિરીઝ માટે ૧૫૦ રૂપિયા
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫ પ્રતિ ચેક
નાણાકીય કારણોસર ઈનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	ર ચેકસુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦ / - થી
ટેકનિકલ કારણોસર ઈનવર્ડ/આઉટવર્ડ ચેક રિઝર્વના શુલ્ક	શૂન્ય
સ્થાયી સૂચનાઓ સેટ અપ/સુધારણા (RD/SIP / બિલ ચુકવણીઓ માટે મફત)	પ્રતિ વખત રૂ. રપ
સ્થાયી સૂચનાઓ નિષ્ક્રિયતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦
નાણાકીય કારણોસર ECS/NACH રીઝર્વ	પ્રતિ વખત રૂ. ર૦૦
SMS ચેતવણીઓ (ડેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	દર મહિને ૧૦ જાનજ મફત. ત્યારબાદ, પ્રતિ જાનજ ૩૦ પૈસા.
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ ^૧	૩.૫%
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
શાખા ખાતે બેલેન્સ પ્રમાણપત્ર (ઓનલાઇન મફત)	પ્રતિ વખત રૂ. રપ૦ / -
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ઓનલાઇન મફત)	વર્ષ દીઠ ૧ મફત, ત્યારબાદ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦
પાસબુક જારી કરવી	મફત
ક્રુસિકેટ પાસબુક જારી કરવી	રૂ. ૫૦
સહીની ચકાસણી પ્રમાણપત્ર / ફોટો પ્રમાણિત/સરનામાની પુષ્ટિ	પ્રતિ વખત રૂ. ૫૦ / -
ક્રુસિકેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૦૦
ક્રુસિકેટ એક્સાઉટ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઇન અથવા ઈમેલ પર)	રૂ. ૫૦
DD/PO પુનઃમાન્યીકરણ/રદીકરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની વિનંતી પર ખાતું બંધ	રૂ. ૫૦૦
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂન્ય
કેસ્ટલ બેંકિંગ *	
ચેક પિકઅપ (ઝોલ પર)	પ્રતિ વખત રૂ. ૫૦ / -
કેસ પિકઅપ બીટ (દર મહિને)	રૂ. ૩૦૦
કેસ પિકઅપ બીટ (દર મહિને શુલ્ક)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
રૂ. ૨,૦૦,૦૦૦ થી રૂ. ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦
રૂ. ૫,૦૦,૦૦૦ થી રૂ. ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
ઝોલ પર કેસ પિકઅપ (ટેક વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦
રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦	રૂ. ૩૦૦
રૂ. ૫૦૦૦૦૦ થી રૂ. ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦
રૂ. ૧૦૦૦૦૦ થી રૂ. ૨૦૦૦૦૦	રૂ. ૮૦૦
રૂ. ૨૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
વ્યવહારોની સંખ્યા	
ગ્રાહક દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનું એકત્રીકરણ જેમાં શામેલ છે:	
રોકડ/ચેક/DSB/DD (ઓનલાઇન અને એટીએમ વડે થયેલ વ્યવહાર સિવાય)	દર મહિને ૮ વ્યવહારો સુધી મફત
સુકત મર્યાદાથી વધુ પર શુલ્ક	વ્યક્તિગત વ્યવહાર શુલ્કની મર્યાદા ઉપરાંત પ્રતિ વ્યવહાર રૂ. ૧૫

^૧વિનંતી પર ફક્ત પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ. લાગુ પડતા કર વધારાના રહેશે જમક= પેચેનલ એટપાર ગસ: લાગુ પડતું નથી જમ: સેવિંગસ એક્સાઉટ ઈમ: ક્રંટ એક્સાઉટ

*નાણાકીય વ્યવહાર તરીકે ગણવામાં આવતા અપૂરતા ભંડેળને કારણે રોકડ ઉપાડ નિષ્ફળ
*ELITE ડેબિટ કાર્ડફક્ત ELITE ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક હવે ELITE પ્રોગ્રામ સ્ટેટ્સ ધરાવતા નથી તો રૂ. જલ્દ શુલ્ક લાગુ પડે છેઘભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં (ડેબિટ કાર્ડ રિપ્લેસમેન્ટ માટે ક્રેડિટ કાર/શાખાનો સંપર્ક કરો જેથી શુલ્ક ટળી શકાય)
કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા ટ્રેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કર) વસૂલવામાં આવશે.
ઘભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા ટ્રેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા કર) વસૂલવામાં આવશે.
આ ઈજમ ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કાર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે ઊદ્યોગિ (માસ્ટકાર્ડવર્લ્ડ) અને ગણુજ (વિઝા પ્લેટિનમ). ફૂપા કરીને નોંધ લો કે બેંકની વિવેકુલુક્ષિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.
ફૂપા કરીને નોંધ લો કે બેંકના વિવેકુલુક્ષિના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.